

Admin office : 306, 3rd floor, Iscon Mall, Above Star Bazar, Jodhpur Cross Road, Ahmedabad-380015 . (India)

Mkt. Office : 303, 3rd floor, Pinnacle Business Park, Prahladnagar to Corporate Road, Makarba, Ahmedabad-380015

Phone: +91-79-4801 0641 / +91-7948925585 Email:decomica_accounts@heritagesurfaces.com

Date: 15th November, 2025

To
BSE Limited
Department of Corporate Services,
Listing Department
P.J. Towers, Dalal Street,
Mumbai- 400 001

Scrip Code: 531227

Dear Sir/Madam,

Subject: Newspaper Advertisement of the Standalone Unaudited Financial Results for the quarter ended on 30th September, 2025

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed clipping of newspaper advertisement of the Standalone Unaudited Financial Results for the quarter ended on 30th September, 2025 which were published in the following newspaper:

1. English- The Financial Express dated 15th November, 2025
2. Gujarati- The Financial Express - Ahmedabad dated 15th November, 2025

Request you to take the same on record.

For Deco Mica Limited


Vijaykumar Agarwal
Managing Director & CEO
DIN: 01869337



| PRASHANT INDIA LIMITED | | | | |
|---|--|--|--|-------------------------------------|
| REGD. 4th Floor Office-407 Union Trade Centre, Udhana Darwaja, Nodh-2107-2111, B/S Apple Hospital, Surat-395002, Gujarat, India., PH-722808658 CIN: L15142GJ1983PLC006574, Email: id.cs.prashantindia@gmail.com, Website: www.prashantindia.info | | | | |
| STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30.09.2025 | | | | |
| Particulars | Quarter ended 30.09.2025 Unaudited | Quarter ended 30.09.2024 Unaudited | Half Year ended 30.09.2025 Unaudited | Year ended 31.03.2025 Audited |
| Total income from operations | 0.93 | 11.92 | 7.93 | 30.29 |
| Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items) | (17.20) | 2.71 | (24.01) | (20.02) |
| Net Profit / (Loss) for the period before tax (After Exceptional and / or Extraordinary items) | 1003.19 | 2.71 | 996.38 | (20.02) |
| Net Profit / (Loss) for the period after tax (After Exceptional and / or Extraordinary items) | 1003.19 | 2.71 | 996.38 | (20.02) |
| Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] | 1003.19 | 2.71 | 996.38 | (20.02) |
| Equity Share Capital | 423.54 | 423.54 | 423.54 | 423.54 |
| Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year) | | | | (3,744.81) |
| Earnings Per Share (of Rs. 10/- each) Basic & Diluted : | 23.69 | 0.06 | 23.52 | (0.47) |

Note: The above is an extract of the detailed Quarterly and half year Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the Stock Exchange websites at www.bseindia.com and on Company's Website at www.prashantindia.info

Date : 14/11/2025
Place : Surat



For Prashant India Limited
Prabhudas M. Gondalia,
Managing Director (DIN: 00014809)

DEBTS RECOVERY TRIBUNAL-I

Ministry of Finance, Department of Financial Service, Government of India

2nd Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380006

FORM NO.22 (Earlier 62) [Regulation 37 (1) DRT Regulations, 2015] [See Rule 52 (1) of the Second Schedule to the Income-tax Act, 1961]
E-AUCTION/SALE NOTICE THROUGH REGD. AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM
PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993

R.C. No. 30/2011 O.A. No. 33/2007

Certificate Holder : Canara Bank, Revadi Bazar, Ahmedabad

vs.

Certificate Debtors : M/s. Navdurga Hosiyari & Ors

To,

CD No.1 M/s. Navdurga Hosiyari,

F/102/Vidhi Shopping Centre, Lilanagar Cross Road, National High Way No. 8, New Bapunagar, Ahmedabad.

CD No.2 Jayesh C. Joshi, C/B/23 Bhagyodaya Tenament, Nr. Bunglow Stand, Naroda, Ahmedabad.

CD No.3 Mrs. Lataben M. Joshi, C/B/23 Bhagyodaya Tenament, Nr. Bunglow Stand, Naroda, Ahmedabad.

CD No.4 Mr. Manoj C. Joshi, C/B/23 Bhagyodaya Tenament, Nr. Bunglow Stand, Naroda, Ahmedabad.

CD No.5 Dhanjibhai M. Vaghela, Tenament No.12, Shri Manav Mandir Housing Society Ltd. B/H RTO, Radhaswami Road, Ranip, Ahmedabad-80.

CD No.6 Bachubhai M. Vaidya, (since deceased, represented though LRs i.e. CD No. 6.1 & CD 6.2)

CD No.6.1 Sanjay Bhachubhai Vaidya,

Tenament No. 11, Shri Manav Mandir Housing Society Ltd., behind RTO Radhaswami Road, Ranip, Ahmedabad-80

CD No.6.2 Anshuman Bachubhai Vaidya,

Tenament No. 11, Shri Manav Mandir Housing Society Ltd., behind RTO Radhaswami Road, Ranip, Ahmedabad-80

CD NO.7. Hasmukhbhai G. Satwara, (since deceased, represented though LRs i.e. CD No. 7.1 & CD 7.2)

CD No.7.1 M/s. Hansaben Hasmukhbhai Satwara,

G-2, Kenyug Co-operative Housing Society Ltd., Nr. Shyamal Bus Stand, Satellite, Ahmedabad-15.

CD No.7.2 Mr. Kunal Hasmukhbhai Satwara,

G-2, Kenyug Co-operative Housing Society Ltd., Nr. Shyamal Bus Stand, Satellite, Ahmedabad-15

The undersigned property will be sold by Public E-auction sale on 19th December 2025 for recovery of sum of Rs.31,34,204/-

(Rupees: Thirty One Lacs Thirty Four Thousand Two Hundred Four Only) plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT-I (less amount already recovered, if any), from M/s. Navdurga Hosiyari & Ors

DESCRIPTION OF PROPERTY

| No. of lots | Description of the Property to be sold with the names of the co-owners where the property belongs to defaulter and any other person as co-owners. | Reserve Price below which the property will not be sold | EMD 10% of Reserve price or Rounded off |
|-------------|---|---|---|
| 1 | 2 | 7 | 8 |

| Lot No. | Reserve Price (in ₹) | 10% EMD (in ₹) |
|---------|----------------------|----------------|
|---------|----------------------|----------------|

| | | | |
|----|--|---------------|--------------|
| 1. | Immovable property being Flat No. G-2, first floor, Block-G, Kenyug Apartment, Kenyug Co-operative Housing Society Ltd., Nr. Shyamal Bus Stand, Satellite, Ahmedabad-380015, constructed on land bearing survey No. 410, final plot No. 209, Town Planning Scheme 3, mouje Vejalpur, Taluka City, Registration District & Sub-District Ahmedabad, having super built up area 99 sq. yards. | ₹ 38,54,700/- | ₹ 3,85,470/- |
|----|--|---------------|--------------|

| | | | |
|----|---|---------------|--------------|
| 2. | Immovable property being Tenement No. 12, Shri Manav Mandir Co-operative Housing Society, situated at behind RTO, Radhaswami Road, Ranip Ahmedabad-382 480 admeasuring about 170 sq mtrs (ground & first floor) constructed on land bearingsurvey No. 361+362+366, sub plot No. 17, final plot No. 36/1 to 36/7, Town Planning Scheme No. 3, mouje Ranip, Taluka City Registration District & Sub District Ahmedabad. | ₹ 82,63,800/- | ₹ 8,26,380/- |
|----|---|---------------|--------------|

| Sr. No | Description | Details |
|--------|--|-----------|
| 3 | Revenue assessed upon the property or any part thereof | Not known |
| 4 | Details of any other encumbrance to which property is liable | Not known |
| 5 | Valuation also state Valuation given, if any, by the Certificate Debtor | No |
| 6 | Claims, if any which have been put forward to the property, and any other known particulars bearing on its nature and value. | Not known |

1. Auction/Bidding shall only be through online electronic mode through e-auction* Website i.e. : <https://indianbankseaction.com>

2. The intending bidders should register the participation with the service provider well in advance and get user ID and password for participating in E-auction. It can be procured only when the requisite earnest money is deposited in prescribed mode below.

3. EMD shall be deposited by through RTGS/NEFT latest by 17.12.2025 as per details as under :

| | |
|------------------------------|---|
| Bank Name and address | Canara Bank, Manilal Mansion in front of kalupur railway station, Revdi Bazar |
| Account Name | Canara Bank |
| Account No. | 209272431 |
| IFSC Code No. | CNRB0000301 |
| Branch | Revadi Bazar |

EMD Deposited thereafter shall not be considered for participation in the e-auction.

4. In addition to above, the copy of PAN Card, Address Proof & Identity Proof, E-mail ID, Mobile Number in case of the company, copy of board resolution passed by the Board of Directors of the company or any other document confirming representation/attorney of the company and the Receipt/Counter File of such deposit should reach to the said service provider through e- auction website by uploading softcopies on or before 17.12.2025 and also hard copies along with EMDs deposit should reach at the Office of Recovery Officer-II, DRT-I Ahmedabad by 17.12.2025. It is also held that earnest money of unsuccessful bidders shall be returned back in the respective accounts such bidders through the same mode of payment.

5. Prospective bidder may avail online training from service provider:

| | |
|-------------------------------|---|
| Name of Auction Agency | M/s. PSB Alliance Pvt Ltd (BAANKNET) |
| Address | Corporate Office:- Unit 1, 3rd Floor, VIOS Commercial Tower, Near. Wadala Truck Terminal, Wadala East, Mumbai |
| Email Address | Support.banknet@psballiance.com |
| Website | https://banknet.com |
| Helpline Nos. | 8291220220, 9892219848, 8160205051 |
| Contact Person | Mr. Ram Sharma |

6. Contact details of CH Bank :

| | |
|------------------------|---|
| Name | Niraj Jharwal Canara Bank |
| Address | Manilal mansion in front of kalupur railway station, Revdi Bazar - 380001 |
| Contact Details | Mobile No. 8238091916, 079-221473839, 9604185880 |
| E-mail | Cb0301@canarabank.com |

7. Prospective bidders are advised to visit website <https://indianbankseaction.com> for detailed terms & conditions and procedure of sale before submitting their bids.

8. The property shall not be sold below the reserve price.

9. The property shall be sold in 2 lots, with Reserve Price as mentioned above lot.

10. The bidder shall improve offer in multiples of Rs. 50,000/- for lot no. 1&2 respectively during entire auction period.

11. The property shall be sold "AS IS WHERE BASIS" and shall be subject to other terms and conditions as published on the official website of the e-auction agency.

12. The highest bidder shall have to deposit 25% of his final bid amount after adjustment of EMD already paid, by immediate next bank working day by 4:00 P.M. through RTGS/NEFT in the account as mentioned above.

13. The successful bidder/auction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property. If the 15th day is Sunday or other Holiday, then on immediate first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the above, the purchaser shall also deposit poundage fee @1% on total sale consideration money (plus Rs.10) through DD in favour of The Registrar, DRT-I, Ahmedabad. The DD prepared towards poundage's fees shall be submitted directly with the office of Recovery Officer, DRT-I, Ahmedabad.

14. In case of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, if the undersigned thinks fit, be forfeited to the Government Account and the defaulting purchaser shall forfeit all claims to the property or the amount deposited. The property shall be resold forthwith, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is subsequently sold.

15. Schedule of auction is as under:-

| | |
|--|--|
| Date and Time of Inspection | 05.12.2025 between 12.00 PM to 2.00 PM |
| Date of uploading proof of EMD/documents | 17.12.2025 Up to 04.00 PM |
| Last Date of submission of hard copies of proof of EMD/documents with office of the recovery Officer | 17.12.2025 Up to 5.00 pm |
| Date and Time of E-Auction | 19.12.2025 Between 12.00 Noon to 2.30 pm (with auto extension clause of 5 minutes, provided sale shall be completed by 3.00 pm.) |

16. The Recovery Officer has the absolute right to accept or reject any bid or bids or to postpone or cancel the e-auction without assigning any reasons.
Issued under my hand and seal of this Tribunal on this day of 06th day of November, 2025.

(Aryan Kumar)
Recovery Officer-II,
DRT-I, Ahmedabad



DECO-MICA LIMITED
(Corporate Identity Number : L20299GJ1988PLC010807)

Regd. Office : 306, 3rd Floor, Iscon Mall, Star Bazar Building, Jodhpur Char Rasta, Ahmedabad - 380 015

STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULT FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2025

| Sr. No | Particulars | Standalone | | | | (Rs. In Lacs) |
|--------|---|-----------------------------|-----------------------------|-----------------------------|----------------------------|----------------------------------|
| | | Quarter ended on 30.09.2025 | Quarter ended on 30.06.2025 | Quarter ended on 30.09.2024 | Half Year Ended 30.09.2025 | For the year ended on 31.03.2025 |
| | | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited |
| 1. | Total Income from Operations (net) | 1659.70 | 1533.81 | 1828.39 | 3462.23 | 7771.97 |
| 2. | Net Profit / (Loss) from ordinary activities before tax | (53.20) | 59.44 | 8.52 | 25.08 | 312.87 |
| 3. | Net profit / (Loss) for the period after tax (after Extraordinary items) | (39.11) | 43.65 | 6.38 | 16.48 | 194.80 |
| 4. | Other Comprehensive Income / (Loss) | (0.63) | (0.62) | (1.84) | (5.52) | (2.50) |
| 5. | Paid Up Equity Share Capital (Face value of Rs. 10/- each) | 420.00 | 420.00 | 420.00 | 420.00 | 420.00 |
| 6. | Reserve (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year) | Nil | Nil | Nil | Nil | Nil |
| 7. | Earnings Per Share (Before & After extraordinary items) (Face Value of Rs. 10/- each) | | | | | |
| | Basic : EPS (Rs.) | (0.93) | 1.04 | 0.15 | 0.39 | 4.64 |
| | Diluted : EPS (Rs.) | (0.93) | 1.04 | 0.15 | 0.39 | 4.64 |

Notes: (1) The above is an extract of the detailed form of Standalone Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full form of the Standalone Audited Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and on Company's website at www.decomicaltd.com.

(2) The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on Friday, 14th November 2025.

By Order of the Board of Directors
For, Deco-Mica Limited
Mr. Vijaykumar D. Agarwal
(Managing Director & CEO)
(DIN No: 01869337)



Date : Ahmedabad
Date : 14.11.2025

Notes : (1) The above is an extract of the detailed format of Standalone Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Audited Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and on Company's website at www.decomicaltd.com. (2) The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on Friday, 14th November 2025.

By Order of the Board of Directors
For, Deco-Mica Limited
Mr. Vijay Kumar D. Agarwal
(Managing Director & CEO)
(DIN No: 01869337)

Place : Ahmedabad
Date : 14.11.2025



LOCKER NOTICE

This is to inform you that the locker holders of **UCO Bank** relating to the following locker accounts have failed and neglected to pay the prescribed locker rent for a long time in spite of our various notices and demands made to them. As per the terms and conditions agreed to by the locker holder the bank will be at liberty to break open the said locker in the event of non-payment of rent. Accordingly it is proposed to break open the said locker on and after 29.11.2025 by serving the formalities and the respective locker holder is advised to approach the branch before the due date and settle the dues to avoid action. The charges for break open would be borne by the renters and the bank reserves the right to take legal action for recovery of the same along with rent arrears/other charges etc.

| Sr. No. | Branch | Locker No. | Locker Rent due from | Name of Customer | Address |
|---------|-------------------------|------------|----------------------|-------------------------------|---|
| 1. | MCU Navrangpura (0213) | AA068 | 01.04.2022 | Malay Dilipkumar Bagdia | 4, Shalibhadra Flat, Nr. Metro Commercial Centre, Opp. Sanskrit Chamber, Opp. Sabakunj Society, Nr. Old High Court, Ahmedabad-380009. |
| 2. | New Cloth Market (0409) | CB338 | 03.03.2021 | Prakash Jayendraprasad Patel | 15, Vrajesh Society, Mulrichar Tenament No. 11, Gebsana Bus Stand, Isanpur, Ahmedabad-380021 |
| 3. | Keshod (0662) | AA084 | 17.04.2021 | Jora Arunbhai Polabhai | Khodiyar krupa, Keshod, Junagadh, Gujarat-362220 |
| 4. | Narayanpura | FB415 | 03.06.2020 | Prahladbhai Chimanlal Parikh | 2, Anamath Society, Naranpura, Ahmedabad - 380013 |
| 5. | Rajkot City (0281) | CB156 | 01.04.2022 | Anasoyaben Chhaganbhai Manani | Sheri No. 2, Kothariya Road, Rajkot - 360006. |
| 6. | Bopal (2564) | AF489 | 01.04.2022 | Hareesh Kanakray Kothari | 42, Yash Tower Part-1, Vejalpur, Ahmedabad - 380051. |
| 7. | Bopal (2564) | AA496 | 01.04.2022 | Phorum J Brahmbhatt | Flat No. 102, Liberty Garden, Road No. 3, Malad (W), Mumbai - 400064. |
| 8. | Paldi | E214 | 04.01.2022 | Sulochana A Shah | H No. 12, Shreyas Flat, Jain Nagar, Paldi, Ahmedabad-380007. |
| 9. | Paldi | FA277 | 04.01.2022 | Sandhya Gopalbhai Shah | PP23, Shantinath Apartment, Vejalpur, Ahmedabad - 380051. |
| 10. | V S Hospital (0696) | EA369 | 31.12.2017 | Hitesh P Delivala | 8, UCO Bank Flat, Hirasbaug, Ambawadi, Ahmedabad - 380006. |

Date : 14.11.2025
Place : Ahmedabad

Authorised Signatory, UCO Bank

BETEX INDIA LIMITED

EXTRACT OF STANDALONE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025 (INR in Lakhs except EPS)

| Sr. No | PARTICULARS | QUARTER ENDED 30-09-2025 (Un-Audited) | HALF YEAR ENDED 30.09.2025 (Un-Audited) | QUARTER ENDED 30-09-2024 (Un-Audited) | YEAR ENDED 31-03-2025 (Audited) |
|------------|--|---------------------------------------|---|---------------------------------------|---------------------------------|
| 1 | Total Income from Operations (net) | 2777.85 | 4933.72 | 2874.65 | 9714.55 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 119.72 | 126.20 | 170.39 | 271.60 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 119.72 | 126.20 | 170.39 | 271.60 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 91.61 | 92.77 | 122.03 | 195.49 |
| 5 | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 91.61 | 92.77 | 122.03 | 195.49 |
| 6 | Equity Share Capital | 150.00 | 150.00 | 150.00 | 150.00 |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | - | - | - | 3210.35 |
| 8 | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) | | | | |
| 1. Basic | | 6.11 | 6.18 | 8.14 | 13.03 |
| 2. Diluted | | 6.11 | 6.18 | 8.14 | 13.03 |

Notice: The above is an extract of the detailed format of Unaudited Financial Results for the 2nd quarter ended September 30, 2025, filed with the Stock Exchange i.e. BSE Ltd. under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Financial Results are available on the website of the Stock Exchange(s), BSE: www.bseindia.com and the Company's website: www.betexindia.com


For, BETEX INDIA LIMITED
Sd/- MANISH SOMANI
Managing Director

PLACE : SURAT
DATE : 14/11/2025

CIN: L17119GJ1992PLC018073

436, GIDC, Pandesara, Surat-394221, Gujarat, INDIA.

Ph.: (91-261) 2898595, FAX : (91-261) 2334189, E-mail : corporate@betexindia.com



Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.


The Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.


Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrower/ Co-borrowers and Guarantors to repay the amount mentioned in the demand notice appended below within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/ Co-Borrowers/ Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Co-Borrowers/ Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this notice.

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital

[illegible]

| LORENZINI APPARELS LIMITED | | | | | | | | | |
|--|--|-------------------|----------------|-----------------|-----------------|---|--|--|--|
| CIN: L17120DL2007PLC163192 | | | | | | | | | |
| Reg. Off: C-64, OKHLA INDUSTRIAL AREA PHASE-I NEW DELHI 110020 | | | | | | | | | |
| Email: cs@mymonteil.com website: www.mymonteil.com | | | | | | | | | |
| | | | | | | Rs. In Lakhs | | | |
| Particulars | | Quarter Ended | | Year Ended | | | | | |
| | | September 30,2025 | 30th June 2025 | 31st March 2025 | 31st March 2025 | | | | |
| | | Unaudited | Unaudited | Unaudited | Audited | | | | |
| Total Income from operations | | | 1,707.34 | 919.08 | 6,342.04 | | | | |
| Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#) | | | 185.62 | 199.85 | 775.38 | | | | |
| Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#) | | | 185.62 | 199.85 | 775.38 | | | | |
| Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#) | | | 141.67 | 96.40 | 583.64 | | | | |
| Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | | | 142.43 | 98.63 | 588.73 | | | | |
| Equity Share Capital (Face value of Rs. 1/- each) | | | 1,727.37 | 1,727.37 | 1,727.37 | | | | |
| Reserves (excluding revaluation reserves as per Balance Sheet of previous accounting year (31.03.2025) | | | | | 3,032.30 | | | | |
| Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) - | | | | | | | | | |
| 1. Basic: | | | 0.08 | 0.06 | 0.34 | | | | |
| 2. Diluted: | | | 0.08 | 0.06 | 0.34 | | | | |
| Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites. www.mymonteil.com | | | | | |  | | | |
| Date: 13/11/2025 | | | | | | | | | |

| <div> <div>श्री जी</div> <div>  NATIONAL GENERAL INDUSTRIES LIMITED </div> </div> <div> Regd. Off: 3rd Floor, Surya Plaza, K-185/1, Sarajulena, New Friends Colony, New Delhi - 110025 Tel. No.: 011-49872442, 19 E-mail: cs@modisteel.net, CIN: L74899DL1987PLC026617 </div> | | | | | | | | | |
|--|--|--------------------------|--------------------------|--------------------------|--------------------------|--------------------------|-----------------------|-----------------------|-----------------------|
| Extract of Un-audited Financial Results for the Quarter and Half Year ended 30th September 2025 | | | | | | | | | |
| (Rs. in Lakhs, Unless Otherwise Stated) | | | | | | | | | |
| Particulars | | Quarter Ended | | | Half Year Ended | | Year Ended | | |
| | | 30-09-2025 Un-audited | 30-06-2025 Un-audited | 30-09-2024 Un-audited | 30-09-2025 Un-audited | 30-09-2024 Un-audited | 31-03-2025 Audited | 31-03-2024 Audited | 31-03-2025 Audited |
| Total Income from operations | | 254.22 | 196.86 | 255.54 | 451.08 | 570.49 | 1198.21 | 1198.21 | 1198.21 |
| Net Profit / (Loss) for the period (before Tax and Exceptional) | | (14.33) | (27.26) | 23.61 | (41.59) | 45.97 | 121.15 | 121.15 | 121.15 |
| Net Profit / (Loss) for the period (before tax and after Exceptional) | | (14.33) | (27.26) | 23.61 | (41.59) | 45.97 | 121.15 | 121.15 | 121.15 |
| Net Profit / (Loss) for the period (after tax and Exceptional) | | (20.86) | (25.23) | 25.67 | (46.09) | 42.62 | 94.28 | 94.28 | 94.28 |
| Equity Share Capital | | 474.46 | 474.46 | 474.38 | 474.46 | 474.38 | 474.46 | 474.38 | 474.46 |
| Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year) | | | | | | | 3147.10 | 3147.10 | 3147.10 |
| Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - | | | | | | | | | |
| - Basic (in Rs.): | | (0.44) | (0.53) | 0.52 | (0.97) | 0.90 | 1.99</ | | |

| <div><div><div>homefirst</div><div>CIN:L65990MH2010PLC240703. Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com</div></div><div><div>Home First Finance Company India Limited</div><div>સહકારી સંસ્થા</div></div></div> | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
|---|---|-----------|-------------|-----------------------------|-----------------------------|-----------------------------|----------------------------|----------------------------------|-----------|-----------|-----------|-----------|---------|----|------------------------------------|---------|---------|---------|---------|---------|----|---|---------|-------|------|-------|--------|----|--|---------|-------|------|-------|--------|----|-------------------------------------|--------|--------|--------|--------|--------|----|--|--------|--------|--------|--------|--------|----|---|-----|-----|-----|-----|-----|----|---|--|--|--|--|--|--|-------------------|--------|------|------|------|------|--|---------------------|--------|------|------|------|------|
| પ્રતિ, અંગત સામગ્રીના નિકાલ માટે નોટીસ | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| <div>રંજના અર્જુન સિંઘ (મુખ્ય દેવાદાર)</div> <div>રો હાઉસ નં. ૦૧ ગ્રીન પુડ વિલા, આંબેડેર ઇન્ડસ્ટ્રી સમૈ, મોતીલાલ ફાટક મોતીલાલ વલસડ, ગુજરાત-૩૬૬૧૮૫, ભાવલ</div> | <div>અર્જુનકુમાર ઉમાશંકર સિંઘ (સહ-દેવાદાર)</div> <div>રો હાઉસ નં. ૦૧ ગ્રીન પુડ વિલા, આંબેડેર ઇન્ડસ્ટ્રી સમૈ, મોતીલાલ ફાટક મોતીલાલ વલસડ, ગુજરાત-૩૬૬૧૮૫, ભાવલ</div> | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| <p>મોંગણ નોટીસ તા. ૦૩.૦૯.૨૦૨૫ મુજબ, દેવાદારે રંજના અર્જુન સિંઘ, અર્જુનકુમાર ઉમાશંકર સિંઘ, ડ્ર. ર.ર.૩૯.૩૯૮૮ - (રૂપિયા બાવીસ લાખ આગવાચાલીસ હજાર ત્રણસો છતાંસી પુણ) ની રકમ પરત સુકવવામાં નિષ્ફળ ગયા હતા. આથી, આદિકૃત આદિકારીએ જણાવેલ નિયમોના નિયમ ૮ અને ૯ સાથે વંચાતી કલમ ૧૩(૪) હેઠળ તેમનાતે પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે દર્શાવેલ મિલકતનો કબજો ૦૭.૧૦.૨૦૨૫ નાં રોજ લઈ લીધો છે.</p> <p>આથી જણાવેલ મિલકતમાં રહેલ સામાન/વંગામો/અંગત મિલકત આ નોટીસ મળ્યાની તારીખથી ૭ દિવસની અંદર રકવાની રહેશે. જો આ સામાન મિલકતમાંથી દૂર કરવામાં નહીં આવે તો, તે કાયદા હેઠળ નિયત પકિયા અનુસરી વેચાણ/નિકાલ કરવામાં આવશે. હોમ ફર્સ્ટ કાયદાના પાલન હેઠળ મિલકતના રહેણેજમાંથી કોષ્ટાપ નુકશાન માટે જવાબદાર ગણાશે નહીં, જેના પરચ અને પરિણામો માટે એકમાત્ર તમે જવાબદાર રહેશો.</p> <p>આથી તમોને અધિકૃત અધિકારી (નિલય પટેલ - ૯૮૨૫૩૦૬૩૭) નો સંપર્ક કરવો ફરજિયાત છે અને આ નોટીસની તારીખથી સતત દિવસની અંદર નીચે જણાવેલ મિલકતમાંથી અંગત સામાનના નિકાલ માટે વ્યવસ્થા કરવી પડશે.</p> <p>જહેનર નોટીસ તમારા પાસેથી આપર્જન સુધીની રકમ સુલવવા માટે હોમ ફર્સ્ટના હક્કો પ્રત્યે પૂર્વગ્રહ વગર જતી કરાઈ છે.</p> | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| આપર મિલકતની વિગત | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| <p>રો હાઉસ નં. ૦૧, ગ્રીન પુડ વિલા, ગુની કમ નં. ૪૧/પોલી ૩/પોલી નં. ૧૪ અને ૪૧/પોલી ૩/પોલી નં. ૧૫, નવો કમ નં. ૧૧૬૭ અને ૧૧૬૮, મોતીલાલ ફાટક પાસે, મોખે-મોતીલાલ, તાલુકો-પારડી, જિલ્લો-વલસડ-૩૬૬૧૮૫, ગુજરાત, મોતીલાલ, ગુજરાત-૩૬૬૧૮૫ મનુ:સીમા : ભલ : પોલી નં. ૧૩, દક્ષિણ : રો હાઉસ નં. ૦૨, પુર્વ : અંદરના રકમ, પશ્ચિમ : પોલી નં. ૦૮ અને ૦૯</p> <p>તારીખ : ૧૧.૧૧.૨૦૨૫ સ્થાન : વાપી, ગુજરાત</p> <p>સહી - અધિકૃત અધિકારી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ લીમીટેડ</p> | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| <div><div>DECO-MICA LIMITED</div><div>(Corporate Identify Number : L20299GJ1988PLC018007)</div><div>Regd. Office : 306, 3rd Floor, Iscon Mall, Star Bazar Building, Jodhpur Char Rasta, Ahmedabad - 380 015</div><div>STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2025</div></div> <table><tr><th rowspan="2">Sr. No</th><th rowspan="2">Particulars</th><th>Quarter ended on 30.09.2025</th><th>Quarter ended on 30.06.2025</th><th>Quarter ended on 30.09.2024</th><th>Half Year Ended 30.09.2025</th><th>For the year ended on 31.03.2025</th></tr><tr><th>Unaudited</th><th>Unaudited</th><th>Unaudited</th><th>Unaudited</th><th>Audited</th></tr><tr><td>1.</td><td>Total Income from Operations (net)</td><td>1650.70</td><td>1533.81</td><td>1828.39</td><td>3462.23</td><td>7771.97</td></tr><tr><td>2.</td><td>Net Profit / (Loss) from ordinary activities before tax</td><td>(53.20)</td><td>59.44</td><td>8.52</td><td>25.08</td><td>312.87</td></tr><tr><td>3.</td><td>Net profit / (Loss) for the period after tax (excluding Revaluation Items)</td><td>(39.11)</td><td>43.65</td><td>6.38</td><td>16.48</td><td>194.80</td></tr><tr><td>4.</td><td>Other Comprehensive Income / (Loss)</td><td>(0.63)</td><td>(0.62)</td><td>(1.84)</td><td>(5.52)</td><td>(2.50)</td></tr><tr><td>5.</td><td>Paid Up Equity Share Capital (Face value of Rs. 10/- each)</td><td>420.00</td><td>420.00</td><td>420.00</td><td>420.00</td><td>420.00</td></tr><tr><td>6.</td><td>Reserve (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)</td><td>Nil</td><td>Nil</td><td>Nil</td><td>Nil</td><td>Nil</td></tr><tr><td>7.</td><td>Earnings Per Share (Before & After extraordinary items) (Face Value of Rs. 10/- each)</td><td></td><td></td><td></td><td></td><td></td></tr><tr><td></td><td>Basic : EPS (Rs.)</td><td>(0.93)</td><td>1.04</td><td>0.15</td><td>0.39</td><td>4.64</td></tr><tr><td></td><td>Diluted : EPS (Rs.)</td><td>(0.93)</td><td>1.04</td><td>0.15</td><td>0.39</td><td>4.64</td></tr></table> <p>Notes : (1) The above is an extract of the detailed format of Standalone Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Audited Financial Results are available on the Stock Exchange websites at www.bseindia.com and on Company's website at www.decomicaltd.com. (2) The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on Friday, 14th November 2025.</p> <div>By Order the Board of Directors For, Deco-Mica Limited Mr. Vijaykumar D. Agarwal (Managing Director & CEO) (DIN No: 01869337)</div> <div></div> <p>Place : Ahmedabad Date : 14.11.2025</p> | | Sr. No | Particulars | Quarter ended on 30.09.2025 | Quarter ended on 30.06.2025 | Quarter ended on 30.09.2024 | Half Year Ended 30.09.2025 | For the year ended on 31.03.2025 | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited | 1. | Total Income from Operations (net) | 1650.70 | 1533.81 | 1828.39 | 3462.23 | 7771.97 | 2. | Net Profit / (Loss) from ordinary activities before tax | (53.20) | 59.44 | 8.52 | 25.08 | 312.87 | 3. | Net profit / (Loss) for the period after tax (excluding Revaluation Items) | (39.11) | 43.65 | 6.38 | 16.48 | 194.80 | 4. | Other Comprehensive Income / (Loss) | (0.63) | (0.62) | (1.84) | (5.52) | (2.50) | 5. | Paid Up Equity Share Capital (Face value of Rs. 10/- each) | 420.00 | 420.00 | 420.00 | 420.00 | 420.00 | 6. | Reserve (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year) | Nil | Nil | Nil | Nil | Nil | 7. | Earnings Per Share (Before & After extraordinary items) (Face Value of Rs. 10/- each) | | | | | | | Basic : EPS (Rs.) | (0.93) | 1.04 | 0.15 | 0.39 | 4.64 | | Diluted : EPS (Rs.) | (0.93) | 1.04 | 0.15 | 0.39 | 4.64 |
| Sr. No | Particulars | | | Quarter ended on 30.09.2025 | Quarter ended on 30.06.2025 | Quarter ended on 30.09.2024 | Half Year Ended 30.09.2025 | For the year ended on 31.03.2025 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| | | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 1. | Total Income from Operations (net) | 1650.70 | 1533.81 | 1828.39 | 3462.23 | 7771.97 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 2. | Net Profit / (Loss) from ordinary activities before tax | (53.20) | 59.44 | 8.52 | 25.08 | 312.87 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 3. | Net profit / (Loss) for the period after tax (excluding Revaluation Items) | (39.11) | 43.65 | 6.38 | 16.48 | 194.80 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 4. | Other Comprehensive Income / (Loss) | (0.63) | (0.62) | (1.84) | (5.52) | (2.50) | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 5. | Paid Up Equity Share Capital (Face value of Rs. 10/- each) | 420.00 | 420.00 | 420.00 | 420.00 | 420.00 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 6. | Reserve (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year) | Nil | Nil | Nil | Nil | Nil | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| 7. | Earnings Per Share (Before & After extraordinary items) (Face Value of Rs. 10/- each) | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| | Basic : EPS (Rs.) | (0.93) | 1.04 | 0.15 | 0.39 | 4.64 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| | Diluted : EPS (Rs.) | (0.93) | 1.04 | 0.15 | 0.39 | 4.64 | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |
| <div><div><div>SBI</div><div>ભારતીય સ્ટેટ બેંક</div><div>સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ, બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ, ડી.આર. સેક્ટર ૧૩, દિવાલીપુરા મેઈન રોડ, વડોદરા-૩૯૦૦૦૭</div></div><div>સરકારી એજન્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩(૪) હેઠળ મિલકતના પ્રત્યક્ષ કબજા અંગેની સૂચના</div></div> <p>આથી સિક્કોરિટાઈઝેશન એન્ડ રીફાઈન્ડરિંગ ઓફ ફાનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્જીનિયરિંગ ઓફ સિક્કોરિટી ઇન્ડેન્ટર એન્ડ, ૨૦૦૨ (૨૦૦૨નો પાઠ) કલમ ૧૩(૧૨) સાથે વાંચો સિક્કોરિટી ઇન્ડેન્ટર (એન્જીનિયરિંગ) ૩૯૯, ૨૦૦૨ના રૂલ ૩ના હેઠળ મળેલા સત્તાનો ઉપયોગ કરીને આ નોટીસ જારી કરવામાં આવે છે કે નીચે જણાવેલ દેકે પાતાઓની સામે અને અહીં નીચે જણાવેલ તારીખે ડીમાન્ડ નોટીસ આપીને તેમોને કબિત નોટીસ મળવાની તારીખથી ૬૦ દિવસમાં તેમના નામ સામે જણાવેલ રકમ પરત સુકવવા જણાવ્યું હતું.</p> <p>દેવાદાર/જામીનદાર (રો) રકમ પરત સુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/જામીનદાર (રો) અને જહેનર જનતાને નોટીસ દ્વારા જણાવવામાં આવે છે કે નીચે સહી કરનારે તેમની મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કબિત એક્ટની કલમ ૧૩(૪) સાથે વાંચતા કબીત રૂલના રૂલ ૮, માનનીય એડિશનલ/ગ્રીડ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ અને દ્વારા ક્રિમિનલ પરચૂરસ અંદર જે નં. ૨૦૨૫ના ૯૨૬૮ દ્વારા પસાર કરાયેલા આદેશનો પાલન કરીને કોર્ટ કમિશનર પાસેથી નીચે જણાવેલ ખાતેની સામે દર્શાવેલી મિલકતની નીચે જણાવેલ તારીખે પ્રત્યક્ષ કબજો લીધો છે.</p> <p>ખાસ કરીને નીચે જણાવેલ દેવાદાર/જામીનદાર (રો) અને જહેનર જનતાને આથી રેતાઈથી અપવામાં આવે છે કે મિલકત (તો) અંગે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને મિલકત સાથે કરેલો કોઈપણ પ્રકારનો વ્યવહાર નોટીસની નીચે દર્શાવેલ બાકી રકમ સાથે વધુ વ્યાજ, ખર્ચ, આકસ્મિક ખર્ચ, ચાર્જિસ વગેરે સહીત રહેશે.</p> <p>સિક્કોરિટી મિલકતી છોડાવા માટે ઉપવર્ણમ</p> | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |